

ASHNISHA INDUSTRIES LIMITED

31st May, 2024

To,
Department of Corporate Services
BSE Limited
Ground Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai- 400 001

Security ID: ASHNI
Security Code: 541702

Sub: Copy of Advertisement of Audited Financial Results for the quarter and year ended on 31st March, 2024.

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of advertisement of Audited Financial Results for the quarter and year ended on March 31, 2024 as per Regulation 47(1) (b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one english daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You.

Yours faithfully,

For Ashnisha Industries Limited

Ashok C. Shah
Managing Director
DIN: 02467830



Encl: As above

China racing ahead in critical technologies: How innovation is the only solution for India

There are multiple disruptions that are taking place currently. The Cold War did provide some kind of stability, though it witnessed multiple conflicts wherein warring sides were either supported by the US or by the Soviet Union or Russia. With

the breakup of the Soviet Union in 1991, the US emerged as the sole superpower, and its fragile stability still continued. With China undertaking major strides in all domains, coupled with its new-found ambition of becoming the sole

superpower of the world, the international narrative of dynamic equilibrium is witnessing a major change.

With Chinese incursions having entered their fifth year in eastern Ladakh, the Russia-Ukraine war continuing in the third year, and the Israel-Hamas conflict continuing in the eighth month, with no end in sight for any of these conflicts, global uncertainties continue. As this emerging geopolitical situation becomes more and more fragile with every passing day, new political alignments are emerging. Russia-China has already entered into a 'no

limit' friendship, with a new alignment emerging in the form of Russia-China-North Korea-Iran. More nations could join this alliance, including Pakistan.

The balancing act expected from India on the geo-political front is an important challenge, but India has been walking a tight rope efficiently so far. India has also been managing the economic issues, including the challenges of the supply chain, reasonably well in the national interest. The biggest challenge that is most disruptive stems from technological disruption, which

is more alarming as compared to geopolitical and economic disruptions. In fact, technological disruptions shape even geopolitical and economic disruptions. The Houthi attack

in the Red Sea using drones and missiles resulted in the US and some other NATO countries mobilising their resources to counter this threat. Technology to be effective need not result in high-end, sophisticated



realme Teases its Upcoming AI Flagship Killer, realme GT6



GT 6 Series. Armed with the conviction to excel in flagship products, realme aims to exceed expectations in all aspects by leveraging their understanding of young users' needs. The GT 6 Series is set to showcase realme's commitment to innovation and quality, making it a highly anticipated release in the smartphone industry.

GT is Back with Ambition-Discussing the intense competition in the high-end smartphone market, Sky Li, Founder and CEO of realme emphasized that realme enters with a fearless spirit, building upon its existing performance strengths and aiming for breakthroughs in the AI arena. This strategic move complements the ongoing success of realme's number series, showcasing the brand's commitment to cater to a wider range of user preferences. (1-7)

Ahmedabad, realme, the Most Reliable Smartphone Service Provider in India, recently launched the latest device in its highly anticipated GT Series. The return marks a strategized focus on the high-end market segment, two years after the last GT Series launch. Sky Li, realme Founder and CEO, is determined to make a significant impact on the high-end market with the all-new

Sports Club is not willing to pay service tax refunds to its members



Ahmedabad, The Sports Club of Gujarat in Nawarangpura area of Ahmedabad has been criticized by its members for its threatening and arbitrary behavior. The club does not have to pay service tax on the charges it collects from its members. The sports club's management is disregarding even the Supreme Court's judgment. Thousands of members have yet to receive their refund for the service tax they paid. And if the club does not clarify when this payment will be received, the members have been warned of mass agitation. Regarding this, Mr. Rajesh Brahmabhat, a member of the Club Members' Protection Committee, said, 'I have been a member of the Sports Club of Gujarat for the last seven years. And I have

made several representations to the club management regarding getting a refund for service tax. The management is acting arrogantly instead of providing a clear or satisfactory answer. According to the club, between 2005 and July 2017, 2,511 members paid service tax on entry fees and are eligible for a refund. The total amount is around Rs. 5 crores, which is equal to 47 lakhs. However, only 243 members received Rs. 75.62 lakh from them up to May 20, 2024. The management is not letting us know when the refund will be given to the remaining members. About 8500 members of the sports club should pay service tax of Rs. He further said, that we, the rest of the club members, have made several representations to the club, but they have fallen on deaf ears.

Truecaller surpasses 400 million active users



Ahmedabad, Truecaller, the leading global platform for verifying contacts and blocking unwanted communication is proud to announce the very significant milestone of 400 million users monthly. Truecaller continues to grow rapidly in many different geographic markets and has since 31 March this year grown with 10.1 million users. Truecaller surpasses 400 million active users - "Reaching 400 million active users each month is something we are, of course, very proud of, but at the same

time, we know that the need for a solution like Truecaller is significantly greater. The problem of unwanted communication, spam, and fraud over the phone is unfortunately only growing for both individuals and businesses. New technology and increased opportunities for fraudsters to make money are driving this development. We continue to develop our app and add new functionality to protect our users before, during, and after a phone call or SMS, says Alan Mamed, co-founder and CEO of Truecaller. (1-7)

Non-Metro banking customers prioritize insurance and transparency

Ahmedabad, Banking customers in metros and non-metros increasingly expect complimentary offers and value-added services as part of their premium savings accounts, whereas higher insurance coverage is important in non-metros, as per a survey conducted among premium segment customers. According to a study conducted by Ujjivan Small Finance Bank, 42% of non-metro customers are interested in premium savings accounts that offer accidental insurance cover of INR 10 lakhs, while 67% of metro customers are more interested in offers related to shopping and travel. One notable feature that was popular among metro and non-metro

customers was complimentary airport lounge access, with 50% of metro customers and 31% of non-metro customers expressing interest. The survey was conducted across 400+ branches of Ujjivan SFB. In non-metro cities, it was found that 50% of customers expressed concerns over hidden charges and high transaction fees, highlighting the need for transparency in banking services. In contrast, 56% of metro customers were worried about limited offers and promotions on their cards, indicating a desire for tailored perks and exclusive benefits. Lack of value-added services emerged as a common challenge amongst both non-metro (37%) and metro customers (33%). (13-9)

CHAIRMAN ISRO, DR. S.SOMANATH INAUGURATES AMITY-ISRO JOINT WORKSHOP



Ahmedabad, Indian Space Research Organisation (ISRO) Chairman, Dr. S. Somanath, along with a team of 25 scientists visited Amity University Bengaluru for a joint workshop on Artificial Intelligence, Data Analytics, and Astrobiology. Dr. Prakash Chauhan, Director of the National Remote Sensing Centre, Hyderabad, and Dr. Sudheer Kumar N, Director of Capacity Building & Public Outreach at ISRO, and distinguished scientists from Amity Universities in Bengaluru, Noida, Gurugram, Mumbai, and Raipur attended the event. Reinforcing his faith and confidence in the institution, Dr. Somanath said, "There are phenomenal opportunities in the space sector, and for integrating AI into space, and for us to work on a sustained, continued basis. I had the opportunity to visit Caltech University in the US and see how their work is

feeding into the NASA mission. Similarly, we need people from across the country who can work and contribute to the growth of the country. I believe that Amity University can build a strong ecosystem for Space, Science & Technology, and this workshop is just the beginning."

He praised the university for its initiative of collaborating with ISRO, understanding the industry challenges, and focusing on translational research. Founder President of Amity Education Group, Dr. Ashok K. Chauhan shared his vision for Amity to be the No. 1 R&D and Academic Partner of ISRO. Amity's Chancellor, Dr. Aseem Chauhan expressed his gratitude, saying "We are so privileged and delighted to have Dr. Somanath with us today at Amity University Bengaluru, and for bringing this collaboration to fruition, at hypersonic speed." (19-10)

Ice Make Refrigeration Limited Q4FY24 Results

Ahmedabad, Ice Make Refrigeration Limited (NSE: ICEMAKE), a leading provider of innovative cooling solutions and a prominent manufacturer of over 50 types of refrigeration equipment in India, has announced a remarkable 65.24% increase in net profit, reaching Rs 14.27 crore, compared to Rs 8.63 crore in the corresponding period of the previous fiscal year. This growth was primarily driven by strong sales. The company's quarterly consolidated revenue for Q4FY24 surged by 22.61%, reaching Rs 140.14 crore compared to Rs 114.28 crore in the same period last

fiscal year. For the fiscal year 2024, Ice Make achieved robust growth with total income reaching Rs 379 crore, marking a 20.95% year-on-year increase from Rs 313.32 crore in the same period of fiscal 2023. This growth was driven by a strong product mix, market demand, and geographical expansion. Efficient cost management strategies and an increased proportion of high-margin products resulted in an EBITDA of Rs 41.39 crore during fiscal 2024. The COGS (Cost of Goods Sold) as a percentage of revenue slightly decreased to 68.59% compared to 70.34% in the previous fiscal year. (1-7)

यूको बैंक **UCO BANK** **BREAK OPENING OF LOCKERS**

(A Govt. Of India Undertaking) **HONOURS YOUR TRUST**

UCO BANK, BOPAL BRANCH, AHMEDABAD

The Following locker holders, who have availed the facility from UCO Bank, Bopal Branch, have neither operated their locker nor deposited locker rent within specified time period, are being informed through this notice to pay the rent within 15 days of publication, failing which the bank reserves the right to satisfy its dues by selling their personal belongings in the locker after breaking it open in line with relevant provisions available in law.

Sr. No.	Locker No.	Name	Rent Due From	Total Rent Due (Penal Charge)
1.	CA666	Sidharth Bhupendrabhai Rawal	15.07.2020	10,445/- + 3349/-

Within 10 days of this publication, the remaining amount will be paid by the locker holder at the expense of the household, except if the locker holder is able to secure the payment.

Date : 30.05.2024, Place : Ahmedabad Authorised Officer, UCO Bank

Teamlease Degree Apprenticeship Highlights ROI

Ahmedabad, TeamLease Degree Apprenticeship, India's premier privately owned Degree Apprenticeship program from the house of TeamLease Services, convened a distinguished event titled "People Supply Chain Innovation: Interpreting the ROI in Apprenticeship" at the ITC Narmada, Ahmedabad. The event aimed to address the critical challenges in talent acquisition and delve into the substantial returns on investment (ROI) from apprenticeships and work-based learning programs. Gujarat has become a top destination for domestic and international investments, ranking among India's top 3 in Manufacturing FDI. The state has a strong labor force participation rate, lower unemployment, and an entrepreneurial spirit, positioning it for economic growth and job creation. However, due to technological disruptions and demographic diversity, organizations face challenges in talent acquisition, engagement, and development. Strategies discussed include developing internal talent, implementing Managed Training Services and Hire-Train-Deploy models, and outsourcing apprenticeship

management. Apprenticeships have shown a 3X ROI over three years, reducing talent acquisition costs by 50% and boosting business productivity by 20-25%. The dialogue also addressed the need for structural reforms to enhance the pace of skill development in India, emphasizing the symbiotic relationship between functional skills and theoretical knowledge. (1-7)

ASHNISHA INDUSTRIES LIMITED					
Registered Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad 380 006. CIN : L74110GJ2009PLC057629					
STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024					
Particulars	Quarter ending	Year ended	Corresponding	Previous	
	31-03-2024	31-03-2024	31-03-2023	31-12-2023	Quarter ending
	Audited	Audited	Audited	Unaudited	
Total income from operations	843.70	1487.33	1057.95	121.59	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	54.18	143.36	51.16	26.84	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	54.18	143.36	51.16	26.84	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	20.27	95.57	27.14	19.84	
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	20.27	95.57	27.14	19.84	
Equity Share Capital	990.00	990.00	990.00	990.00	
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)					
Basic :	0.020	0.100	0.027	0.020	
Diluted :	0.020	0.100	0.027	0.020	
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualised)					
Basic :	0.020	0.100	0.027	0.020	
Diluted :	0.020	0.100	0.027	0.020	
EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024					
(Rs. In Lakhs)					
Particulars	Quarter ending	Year ended	Corresponding	Previous	
	31-03-2024	31-03-2024	31-03-2023	31-12-2023	Quarter ending
	Audited	Audited	Audited	Unaudited	
Total income from operations	18.02	535.40	371.95	105.52	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	7.49	84.46	17.83	24.03	
Profit after tax	5.78	65.12	4.99	23.05	
Notes:					
The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.ashnisha.in)					
For, ASHNISHA INDUSTRIES LIMITED					
SD/-					
ASHOK C. SHAH					
MANAGING DIRECTOR					
DIN: 02467830					
Date : 29-05-2024					
Place : Ahmedabad					

WESTERN RAILWAY

CONSTRUCTION WORK

Deputy Chief Electrical Engineer (Construction), Western Railway, 1st floor Station Building, Room No. 165, Churchgate, Mumbai 400 020 invites E-Tender Notice No: EL-92-12-C-CCG-2024-25-01 Name of Work: GEB Overhead LT/HT Railway Track Crossing by Under Ground High Tension cable in connection with (GC) Gauge conversion in between KOSAMBA-UMARPADA section of BRC Division of Western Railway. NIT cost: ₹56,98,361/- EMD: ₹1,14,000/- e-Bid submission closing: till 21.06.2024, 15.00 Hrs. e-Bid opening date (Technical Bid): on 21.06.2024 at 15:30 Hrs. For further details please visit our website www.treps.gov.in. 0192

Like us on : [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

SHRIRAM HOUSING FINANCE LIMITED

Head Office: Level -3, Wockhardt Towers, East Wing C-2 Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051; **Tel:** 022 4241 0400, 022 4060 3100 ; **Website:** <http://www.shriramhousing.in>

Reg. Off: No.123, Angappa Naicken Street, Chennai-600 001; **Branch Office:** 202-207, 323 Corporate Park, Near Girish Cold Drink Cross Road, Beside Samundra Complex, C G Road, Ahmedabad-Gujarat- 380 009

APPENDIX-IV-A [SEE PROVISION TO RULE 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s that the below described immovable properties mortgaged/ charged to The Shirram Housing Finance Limited, The Physical possession of which have been taken by the Authorized Officer of The Shirram Housing Finance Limited, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis in e-auction for recovery of the balance due to The Shirram Housing Finance Limited from the Borrowers And Guarantors, as mentioned in the table. Details of Borrowers and Guarantors, amount due, Short Description of the immovable property and encumbrances known thereon, possession type, reserve price and earnest money deposit, Date and Time of Auction are also given as:

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagors	Date & Amount of 13(2) Demand Notice	Description of Property	Reserve Price (Rs.) & Bid Increment	Earnest Money Deposit Details (EMD) Details.	Date & Time of Auction	Contact Person and Inspection date
1. Sapkade Anita Sanjaybhai, 2. Sapkade Sanjay Badiram, 3. Sapkade Shital Sanjaybhai, Present Address:- 1553-A-45, Mohanlal Ni Chali, Narshiji Nu mandir, Gontipur, Ahmedabad-380021 Also Address :- Flat No.B-405, 4th Floor, Sitaram City, Near Vastral, Sub Post office, Mouje : Vastral, Tal: Vatva Ahmedabad-382418	demand notice dated. 07.02.2024 Rs.21,81,711/- (Rupees Twenty One Lakh Eighty One Thousand Seven Hundred Eleven Only) as on 07-02-24 under reference of Loan Account No. SHLHAHEA000 1455	All that piece and parcel of Immovable Property being Flat No.B/405, on 4th Floor (As per plan 3rd Floor), having area admeasuring 36.85 Sq.Mtrs., Carpet(including wash balcony admeasuring 2.94 sq.mtrs.) alongwith undivided share land adme.26.58 sq.mtrs in the scheme known as "Sitaram City", a scheme constructed on Freehold Non-Agricultural land bearing Final Plot No.9/2, admeasuring 9581.40 sq.mtrs allotted in lieu of Revenue Survey no.1021/2, Town planning scheme no.105 (Vastral-Ramol) of Mouje:Vastral of Taluka : Vatva in the District of Ahmedabad and Registration Sub District of Ahmedabad-12(Nikol). Boundaries of the property:- East:- Block No.A West:- Open Passage North : Common Plot South : Flat No.B-406	Rs.14,00,000/- (Rupees Fourteen Lakh Only) Bid Increment Rs.10,000/- and in such multiples Earnest Money Deposit (EMD) (Rs.) Rs.1,40,000/- (Rupees One Lakh Forty Thousand Only) Last Date for Submission of EMD. 29th June, 2024, Time 10.00 a.m. to 05.00 p.m.	EMD amount to be deposited by way of RTGS/ NEFT to the account details mentioned herein below: BANK NAME- AXIS BANK LIMITED BRANCH- BANDRA KURLA COMPLEX, MUMBAI BANK ACCOUNT NO - Current Account No. 91102004567763 3 IFSC CODE - UTIB0000230	1st July, 2024 & Time. 11.00 a.m. to 01.00 p.m.	Ashfaq Patka-98194 15477 Moh'd Shafiq M.Shaikh-99786 24614 Hiteshkumar Joshi-98799 40713 Dharmendra sinh Chauhan-76007 62777 Customer Care Number :- 022 - 40081572 Property Inspection Date:7th June 2024, Time.10.00 a.m. to 12.00 p.m

for detailed terms and conditions of the sale, bid form, training & others may also visit website of Shirram Housing Finance Limited at <http://shriramhousing.in/e-auction-Residential> provided in the Shirram Housing Finance Limited website. **STATUTORY 30 DAYS SALE NOTICE FOR SUBSEQUENT SALE UNDER RULE 8(6) AS PER AMENDED SARFAESI ACT, 2002.** The mortgagors/borrowers are given a last chance to pay the total dues with further interest before auction, failing which secured assets will be sold as per above schedule. The mortgagors/borrowers are Request to take back all movable items which are inside the property. **NB: Please note that the secured creditor is going to issue the sale notice to all the Borrowers/ Guarantors/ Mortgagors by speed/ registered post. In case the same is not received by any of the parties, then this publication of sale notice may be treated as a substituted mode of service**
Place : Ahmedabad Sd/- Authorised Officer
Date : 31-05-2024 Shriram Housing Finance Limited

